

ASY

PROVISIONAL ANSWER KEY (CBRT)

Name of the post	Assistant Manager (Public Relation) (GMDC) ,Class-2
Advertisement No.	33/2020-21
Preliminary Test held on	04-07-2021
Question No.	001 – 300 (General Studies & Concern Subject)
Publish Date	06-07-2021
Last Date to Send Suggestion(s)	13-07-2021
THE LINK FOR ONLINE OBJECTION SYSTEM WILL START FROM 07-07-2021; 12:00 PM ONWARDS	

Instructions / સૂચન

Candidate must ensure compliance to the instructions mentioned below, else objections shall not be considered: -

- (1) All the suggestion should be submitted through **ONLINE OBJECTION SUBMISSION SYSTEM** only. Physical submission of suggestions will not be considered.
- (2) Question wise suggestion to be submitted in the prescribed format (proforma) published on the website / online objection submission system.
- (3) All suggestions are to be submitted with reference to the Master Question Paper with provisional answer key (Master Question Paper), published herewith on the website / online objection submission system. Objections should be sent referring to the Question, Question No. & options of the Master Question Paper.
- (4) Suggestions regarding question nos. and options other than provisional answer key (Master Question Paper) shall not be considered.
- (5) Objections and answers suggested by the candidate should be in compliance with the responses given by him in his answer sheet. Objections shall not be considered, in case, if responses given in the answer sheet /response sheet and submitted suggestions are differed.
- (6) Objection for each question should be made on separate sheet. Objection for more than one question in single sheet shall not be considered.

ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા-સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં

- (1) ઉમેદવારે વાંધા-સૂચનો ફક્ત ઓનલાઇન ઓબ્જેક્શન સબમીશન સીસ્ટમ દ્વારા જ સબમીટ કરવાના રહેશે. રૂબરૂ અથવા ટપાલ દ્વારા આયોગની કચેરીએ મોકલવા આવેલ વાંધા-સૂચનો ધ્યાને લેવામા આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.
- (2) ઉમેદવારે વાંધા-સૂચનો રજૂ કરવા વેબસાઇટ / ઓનલાઇન ઓબ્જેક્શન સબમીશન સીસ્ટમ પર પ્રસિધ્ધ થયેલ નિયત નમૂનાનો જ ઉપયોગ કરવો.
- (3) ઉમેદવારે પોતાને પરીક્ષામાં મળેલ પ્રશ્નપુસ્તિકામાં છપાયેલ પ્રશ્નક્રમાંક મુજબ વાંધા-સૂચનો રજૂ ન કરતા તમામ વાંધા-સૂચનો વેબસાઇટ પર પ્રસિધ્ધ થયેલ પ્રોવિઝનલ આન્સર કી (માસ્ટર પ્રશ્નપત્ર)ના પ્રશ્ન ક્રમાંક મુજબ અને તે સંદર્ભમાં રજૂ કરવા.
- (4) માસ્ટર પ્રશ્નપત્રમાં નિર્દિષ્ટ પ્રશ્ન અને વિકલ્પ સિવાયના વાંધા-સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં.
- (5) ઉમેદવારે પ્રશ્નના વિકલ્પ પર વાંધો રજૂ કરેલ છે અને વિકલ્પ રૂપે જે જવાબ સૂચવેલ છે એ જવાબ ઉમેદવારે પોતાની ઉત્તરવહીમાં આપેલ હોવો જોઈએ. ઉમેદવારે સૂચવેલ જવાબ અને ઉત્તરવહીનો જવાબ ભિન્ન હશે તો ઉમેદવારે રજૂ કરેલ વાંધા-સૂચનો ધ્યાનમા લેવાશે નહીં.
- (6) એક પ્રશ્ન માટે એક જ વાંધા-સૂચન પત્રક વાપરવું. એક જ વાંધા-સૂચનો પત્રકમાં એકથી વધારે પ્રશ્નોની રજૂઆત કરેલ હશે તો તે અંગેના વાંધા-સૂચનો ધ્યાને લેવાશે નહીં.

Website link for online objection submission system : http://150.129.165.5/GPSC_Suggestion/

001. 2011ના સેન્સસ મુજબ ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા કયા પ્રથમ ત્રણ રાજ્યો છે ?
- (A) ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર (B) મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન
(C) બિહાર, મધ્ય પ્રદેશ, ઓડિશા (D) મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ
002. 2011ના સેન્સસ મુજબ, ભારતના કયા રાજ્યમાં વસ્તીની ઘનતા (Density of population) સૌથી વધારે અને સૌથી ઓછી છે ?
- (A) બિહાર અને નાગાલેન્ડ (B) બિહાર અને અરુણાચલ પ્રદેશ
(C) ઉત્તર પ્રદેશ અને ગોવા (D) મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ
003. નીચેના વાક્યો પૈકી કયા વાક્યો યોગ્ય છે ?
1. ગુજરાત રાજ્યની સરહદ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દીવ અને દમણ તથા દાદરા નાગર હવેલીની સરહદને સ્પર્શે છે.
 2. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1961ના રોજ થયેલ હતી.
 3. ગુજરાતનો સાક્ષરતા દર (2011 ના સેન્સસ મુજબ) 78.03% છે અને 2011ના સેન્સસ મુજબ સેક્સ રેશીયો 919 છે.
- (A) 1 અને 2 વાક્યો યોગ્ય છે. (B) 2 અને 3 વાક્યો યોગ્ય છે.
(C) 1 અને 3 વાક્યો યોગ્ય છે. (D) 1, 2 અને 3 બધાજ વાક્યો યોગ્ય છે.
004. નીચેના વાક્યો પૈકી કયા વાક્યો યોગ્ય છે ?
1. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-7, કે જે વારાણસીને કન્યાકુમારીથી જોડે છે તે સૌથી લાંબો ધોરીમાર્ગ છે.
 2. દિલ્લી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકત્તાને જોડવા સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું આયોજન છે.
 3. મહાત્મા ગાંધી એક્સપ્રેસ હાયવે/નેશનલ એક્સપ્રેસ હાયવે-1 અમદાવાદ-વડોદરાને જોડે છે.
- (A) 1, 2 અને 3 (B) 1 અને 3
(C) 1 અને 2 (D) 2 અને 3
005. રેલ્વેના મુખ્ય વિભાગો અને તેના મુખ્ય કેન્દ્રને જોડો.
- | | |
|----------------------|--|
| 1. મધ્ય રેલ | a. કોલકત્તા |
| 2. પૂર્વ રેલ | b. હાજીપુર |
| 3. પૂર્વ મધ્ય રેલ | c. હુબલી |
| 4. દક્ષિણ પશ્ચિમ રેલ | d. મુંબઈ - છત્રપતિ શીવાજી મહારાજ ટર્મીનસ |
- (A) 1 - c, 2 - d, 3 - a, 4 - b (B) 1 - b, 2 - c, 3 - d, 4 - a
(C) 1 - a, 2 - b, 3 - c, 4 - d (D) 1 - d, 2 - a, 3 - b, 4 - c
006. નીચેના વાક્યો ચકાસો :
1. ઈશાન ભારતના પહાડી રાજ્યોમાં બારેમાસ લીલા રહેતા જંગલો આવેલ છે.
 2. પૂર્વઘાટ અને પશ્ચિમ ઘાટના ઢોળાવા પર ખરાઉ જંગલો આવેલ છે. પાનખર ઋતુમાં પાંદડા ખરી જાય છે.
 3. હિમાલયના ઉંચા પહાડો પર ગીચ પ્રમાણમાં તાડ, કેવડો, સુંદરી, ચેર જેવા વૃક્ષો ગીચ પ્રમાણમાં ઉગે છે.
- (A) 1 અને 3 યોગ્ય છે. (B) 2 અને 3 યોગ્ય છે.
(C) 1 અને 2 યોગ્ય છે. (D) 1, 2 અને 3 યોગ્ય છે.

007. નીચેના વાક્યો પૈકી કયુ વાક્ય યોગ્ય છે ?

1. સામાન્ય અથવા આકાશીય ખેતીમાં જુવાર, બાજરી, મકાઈ જેવા પાકો થાય છે.
2. ઘઉંના પાક માટે સૂકી ખેતી લાયક જમીન ઘણી ઉપયોગી છે.
3. સિંચાઈની ખેતીથી શેરડી, કપાસ, શણ, ડાંગર જેવા પાકોનું ઉત્પાદન થાય છે.
4. બાગાયતી ખેતીમાં ચા, કોફી જેવા પાકોનો સમાવેશ થાય છે.

(A) 1, 2 અને 3

(B) 1, 2 અને 4

(C) 2, 3 અને 4

(D) 1, 2, 3 અને 4

008. ભારતના રાજ્યો અને તેની રાજધાની (Capital) ને યોગ્ય રીતે જોડો.

- | | |
|-------------------|-----------|
| 1. અરુણાચલ પ્રદેશ | a. ઈટાનગર |
| 2. આસામ | b. દિસપુર |
| 3. મણિપુર | c. ઈફાલ |
| 4. મેઘાલય | d. શિલોંગ |

(A) 1 - b, 2 - c, 3 - d, 4 - a

(B) 1 - a, 2 - b, 3 - c, 4 - d

(C) 1 - c, 2 - d, 3 - a, 4 - b

(D) 1 - d, 2 - a, 3 - b, 4 - c

009. દેશના કિલ્લાઓ (Fort) અને સંબંધિત શહેર/રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

- (A) પન્હાળા ફોર્ટ (Panhala Fort) – મહારાષ્ટ્ર
- (B) ગોલકોંડા ફોર્ટ (Golconda Fort) – હૈદરાબાદ
- (C) મેહરનગઢ ફોર્ટ (Mehrangarh Fort) – રાજસ્થાન
- (D) કાંગરા ફોર્ટ (Kangra Fort) – છત્તીસગઢ

010. નીચેના વાક્યો ચકાસો અને કયા વાક્યો યોગ્ય છે ?

1. ભાગીરથી નદી પર બાંધવામાં આવેલ તહેરી ડેમ (Tehri Dam) ભારતમાં આવેલ સૌથી ઉંચો ડેમ છે.
2. હિરાકુંડ ડેમ (Hirakund Dam) ઓડિશા રાજ્યમાં આવેલ છે અને તે સૌથી લાંબો છે.
3. દાંતીવાડા ડેમ (Dantiwada Dam) છત્તીસગઢમાં આવેલ છે અને તે મહાનદી ઉપર છે.

(A) 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.

(B) 1 અને 2 વાક્યો યોગ્ય છે.

(C) 1 અને 3 વાક્યો યોગ્ય છે.

(D) 2 અને 3 વાક્યો યોગ્ય છે.

011. ટાયગર (Tiger Reserve) રીઝર્વ ક્ષેત્ર અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

(A) નમડાફા (Namdapha) – આંધ્ર પ્રદેશ

(B) પકી (Pakke) – અરુણાચલ પ્રદેશ

(C) ઓરાંગ (Orang) – આસામ

(D) ઈન્દ્રાવટી (Indravati) – છત્તીસગઢ

012. “સત્યમેવ જયતે” લખાણ કે જે ભારતના રાજચિહ્ન (Indian Emblem) સાથે લખવામાં આવે છે તે શામાથી લેવામાં આવેલ છે ?

(A) ઋગવેદ – Rigved

(B) સતપથ બ્રહ્મણ – Satpath Brahmana

(C) મુંડક ઉપનીશદ – Mundak Upnishad

(D) રામાયણ – Ramayana

013. ભારતના પ્રખ્યાત નૃત્ય પ્રકાર અને સંબંધિત રાજ્યોને યોગ્ય રીતે જોડો :
- | | |
|-------------------------|-----------------|
| 1. કથક (Kathak) | a. કાશ્મિર |
| 2. કથક કલી (Kathakali) | b. આંધ્ર પ્રદેશ |
| 3. કુચીપુડી (Kuchipudi) | c. કેરળા |
| 4. રઉફ (Rouf) | d. ઉત્તર પ્રદેશ |
- (A) 1 - c, 2 - b, 3 - a, 4 - d (B) 1 - d, 2 - c, 3 - b, 4 - a
(C) 1 - b, 2 - a, 3 - d, 4 - c (D) 1 - a, 2 - d, 3 - c, 4 - b
014. વાદ્ય (instrument) અને વાદકની કઈ જોડીઓ યોગ્ય છે ?
- | |
|---------------------------------|
| 1. સંતુર – પંડીત શીવકુમાર શર્મા |
| 2. સરોદ – નીખીલ બેનરજી |
| 3. બીન – અસદ અલી ખાન |
| 4. મેન્ડોલીન – બ્રીજ ભુષણ કાબરા |
- (A) 1 અને 2 (B) 1 અને 3
(C) 1 અને 4 (D) 1, 2, 3 અને 4 બધાજ યોગ્ય છે.
015. ભારતની અલગ-અલગ સાડીઓ અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકાઓ પૈકી કયા જોડકા યોગ્ય છે ?
- | |
|---|
| 1. આશાવલી (Ashavali Saree) – ગુજરાત |
| 2. બાલુચારી સાડી (Baluchari Saree) – ઉત્તર પ્રદેશ |
| 3. બોમકી સાડી (Bomkai Saree) – ઓડીશા |
| 4. કસવુ સાડી (Kasavu Saree) – તામીલનાડુ |
- (A) 1 અને 2 (B) 1 અને 3
(C) 1 અને 4 (D) 1, 2, 3 અને 4
016. ભારતના પ્રખ્યાત મંદિરો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
- | |
|---|
| (A) બદ્રીનાથ મંદિર (Badrinath Temple) – ઉત્તરાખંડ |
| (B) કોનાર્ક સુર્ય મંદિર – ઓડીશા |
| (C) રામેશ્વરમ મંદિર – આંધ્ર પ્રદેશ |
| (D) સિદ્ધી વિનાયક ગણેશ મંદિર (Siddhi Vinayak Temple) – મહારાષ્ટ્ર |
017. હિન્દી ભાષાના લેખકો અને તેમના યોગદાનને યોગ્ય રીતે ગોઠવો.
- | | |
|-------------|-----------------------|
| 1. તમસ | a. રામધારી સિંહ-દિનકર |
| 2. કમાયની | b. ફણીશ્વરનાથ રેણું |
| 3. મૈલા ઓચલ | c. જયશંકર પ્રસાદ |
| 4. રશ્મિરથ | d. ભીષ્મ સહાની |
- (A) 1 - c, 2 - b, 3 - a, 4 - d (B) 1 - d, 2 - c, 3 - b, 4 - a
(C) 1 - b, 2 - a, 3 - d, 4 - c (D) 1 - a, 2 - d, 3 - c, 4 - b
018. હાલમાં બૌદ્ધ ધર્મના પુરાતત્વીય અવશેષો ગુજરાતમાં કયા સ્થળેથી મળેલ છે ?
- | | |
|----------------|----------------------------|
| (A) બાઘ (Bagh) | (B) દેવની મોરી (Devnimori) |
| (C) સારનાથ | (D) કપીલ વસ્તુ |

019. વિજય સ્થંભ “Vijay Stambha” કયા સ્થળે આવેલ છે ?
- (A) જયપુર (B) ઉદયપુર
(C) ચીત્તોડગઢ (D) અજમેર
020. ‘રાષ્ટ્રીય દફતર ભંડાર’ ‘National Archives’ કયા સ્થળે આવેલ છે ?
- (A) નવી દિલ્હી (B) કલકત્તા
(C) દહેરાદુન (D) મુંબઈ
021. ગુજરાતી ભાષાના પાત્રો અને તેની રચના કરનાર લેખકની જોડીઓ ગોઠવો.
- | | |
|----------------------------|--|
| 1. રમઝુ શરણાઈ વાળો | a. શ્રી દલપતરામ |
| 2. ગોવિંદ - રાજપુર ગામવાળો | b. શ્રી કનૈયાલાલ મુનશી |
| 3. મુંજાલ | c. શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી - ધૂમકેતુ |
| 4. જીવરામ ભટ્ટ | d. શ્રી યુન્નીલાલ મડીયા |
- (A) 1 - d, 2 - c, 3 - b, 4 - a (B) 1 - c, 2 - b, 3 - a, 4 - d
(C) 1 - b, 2 - a, 3 - d, 4 - c (D) 1 - a, 2 - d, 3 - c, 4 - b
022. નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે ?
1. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણેરે – લેખક નરસિંહ મહેતા.
2. એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ – લેખક અખા ભગત
3. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, જનનીના હેયામાં પોઢતા પોઢતા, પીછો કસુંબીનો રંગ – લેખક ઝવેરચંદ મેઘાણી
- (A) 1 અને 2 (B) 2 અને 3
(C) 1 અને 3 (D) 1, 2 અને 3
023. ગુજરાતી લેખકો અને તેઓના ઉપનામની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
- (A) અબ્બાસ અબ્દુલ અલી વાસી – મરીઝ (B) મધુસૂદન વલ્લભદાસ ઠાકર – મધુરાય
(C) ઝીણાભાઈ રતનજી દેસાઈ – સ્નેહરશ્મિ (D) સુરસિંહજી તપ્તસિંહજી ગોહિલ – કેકારવ
024. નીચેના પૈકી હડપ્પન સંસ્કૃતિનું કયુ સ્થળ કચ્છમાં આવેલ છે ?
- (A) દેશલપર (B) બાબરકોટ
(C) રોઝડી (D) રંગપુર
025. મહમૂદ ગઝનીએ સોમનાથ ઉપર ચડાઈ કરી ત્યારે ગુજરાતનો રાજ્ય કારભાર કોણ સંભાળતો હતો ?
- (A) કર્ણદેવ પહેલો (B) ભીમદેવ પહેલો
(C) કર્ણદેવ બીજો (D) ભીમદેવ બીજો
026. નીચેની બાબત કયા રાજવીના સમયમાં બનેલ હતી ?
1. ભૃગુકચ્છ (ભરૂચ) અને સ્થંભતીર્થ (ખંભાત) જેવા અગત્યના બંદરો તેના રાજ્યમાં હતા.
2. ચીની યાત્રાળુ ફાહિયાને રાજ્યની સમૃદ્ધીના ખુબ વખાણ કરેલ હતા.
3. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયેલ હતો.
- (A) સમ્રાટ સમુદ્રગુપ્ત (B) સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો - વિક્રમાદિત્ય
(C) કુમાર ગુપ્ત પહેલો (D) સમ્રાટ અશોક

027. પ્રાચીન ભારતની શિક્ષણ આપતી સંસ્થાઓ અને તેના સ્થાન અંગેના વાક્યો પૈકી કયું વાક્ય યોગ્ય નથી ?
- (A) હાલના ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા શૈક્ષણિક સ્થાન હતું.
 (B) હાલના બિહારમાં નાંલદા વિદ્યાપીઠ આવેલ હતી.
 (C) હાલના ગુજરાતમાં ઓદાનીપુરી જ્ઞાનની વિદ્યાપીઠ હતી.
 (D) હાલના બંગાળમાં વિક્રમશિલા વિદ્યાપીઠ અસ્તિત્વમાં હતી.
028. દક્ષિણ ભારતમાં, નીચેના પૈકી કયા રાજ્ય - સામ્રાજ્યો ન હતા ?
- (A) કલ્યાણીનો ચાલુક્ય વંશ, ચેર વંશ
 (B) પલ્લવ વંશ, પાંડ્ય વંશ
 (C) ચોલા વંશ
 (D) પ્રતિહાર, પાલ વંશ
029. નીચેના વાક્યો ચકાસો :
1. ગર્વનર જનરલ વેલેસ્લીની સહાયકારી યોજના - વિસ્તારવાદની યોજનાના ઘણા રજવાડાઓ ભોગ બનેલ હતા.
 2. ડેલ હાઉસી દ્વારા “ખાલસાનીતિ”નો અમલ શરૂ કરેલ હતો અને તેના ભોગ બ્રહ્મદેશ, સાતારા, ઝાંસી, નાગપુર જેવા રાજ્યો બન્યા હતા.
- (A) પ્રથમ વાક્ય યોગ્ય છે. (B) બીજું વાક્ય યોગ્ય છે.
 (C) પ્રથમ અને બીજું, બન્ને વાક્યો યોગ્ય છે. (D) પ્રથમ અને બીજું, બન્ને વાક્યો યોગ્ય નથી.
030. 1857ના સંગ્રામ સંબંધમાં નીચેના વાક્યો ચકાસો :
1. ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસની આગેવાની નીચે સંગ્રામ છેડ્યો હતો.
 2. ચાંડુપ (ચાંપડ) ગામના લોકોએ નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારી સંગ્રામમાં જોડાયેલ હતા.
 3. ઉત્તર ગુજરાતમાં પાટણ, ખેરાલુ, ભિલોડી, મુડેટી જગ્યાએ પણ સંગ્રામ શરૂ થયેલ હતો.
- (A) 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. (B) 1 અને 2 વાક્યો યોગ્ય છે.
 (C) 2 અને 3 વાક્યો યોગ્ય છે. (D) 1 અને 3 વાક્યો યોગ્ય છે.
031. દેશના સત્યાગ્રહો અને સમય ગાળાને યોગ્ય રીતે જોડો :
- | | |
|----------------------|--------------|
| 1. ચંપારણ સત્યાગ્રહ | a. 1928 |
| 2. ખેડા સત્યાગ્રહ | b. 1917 |
| 3. અસહકારનું આંદોલન | c. 1917-1918 |
| 4. બારડોલી સત્યાગ્રહ | d. 1920-1922 |
- (A) 1 - d, 2 - a, 3 - b, 4 - c (B) 1 - c, 2 - d, 3 - a, 4 - b
 (C) 1 - b, 2 - c, 3 - d, 4 - a (D) 1 - a, 2 - b, 3 - c, 4 - d
032. નીચેના પૈકી કયા મહાનુભાવો વિદેશમાં ક્રાન્તીકારી પ્રવૃત્તિમાં સક્રિય ક્રાન્તિકારીઓ હતા ?
1. શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા
 2. વીર સાવરકર, લાલા હરદયાલ, ઉધમસિંહ
 3. રાજા મહેન્દ્ર પ્રતાપ, સરદારસિંહ રાણા, રમણ પિલ્લાઈ
 4. મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ડૉ. મથુરસિંહ “ખુદાબક્ષ”
- (A) 1, 2 અને 3 (B) 1, 3 અને 4
 (C) 1, 2 અને 4 (D) 1, 2, 3 અને 4

033. ગુપ્ત અને હર્ષકાલીન સંસ્કૃત સાહિત્યની શ્રેષ્ઠતમ કૃતિઓ, તેના લેખકો અને કૃતિના પ્રકારની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
- (A) સ્વપ્નવાસવદત્તમ્ → ભાસ → નાટક (B) કુમાર સંભવ → કાલિદાસ → મહાકાવ્ય
(C) પંચતંત્ર → વિષ્ણુ શર્મા → વાર્તા સંગ્રહ (D) શિશુપાલ વધ → ભારવી → ખંડકાવ્ય
034. સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળ ચલાવનાર મહાનુભાવો અને તેઓના સંસ્થાની જોડીઓ, પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
- (A) રાજા રામ મોહન રાય – બ્રમ્હો સમાજ
(B) જ્યોતિબા કુલે – સત્ય શોધક સમાજ
(C) સ્વામી દયાનંદ સરસ્વતી – આર્ય સમાજ
(D) કુન્દ કુરિ વીરેસલિંગમ – નારાયણ માનવ જીવન પરિપાલન યોગમ
035. વિજયનગર સામ્રાજ્યના અવશેષ આજે કયા સ્થળે મળી આવે છે ?
- (A) બીજાપુર – Bijapur (B) ગોલકોન્ડા – Golconda
(C) હમ્પી – Hampi (D) વડોદરા – Vadodara
036. ફ્રેન્ચોની સર્વોપરીતાનો અંત તથા અંગ્રેજોની સર્વોપરીતા કયા યુદ્ધને કારણે સ્થાપીત થઈ ?
- (A) બંદીવાશનું યુદ્ધ – Wandiwash War
(B) બક્સરનું યુદ્ધ – The battle of Buxar
(C) શ્રી રંગપટનમનું યુદ્ધ – The battle of Seringapatnam
(D) પ્લાસીનું યુદ્ધ – The battle of Plassey
037. નીચેના વાક્યો ચકાસો :
- ભારત દેશ “બાસમતી ચોખા”નો સૌથી મોટો નિકાસ કરનાર દેશ છે.
 - બાસમતી ચોખાનું મુખ્યત્વે ઉત્પાદન દક્ષિણ અને મધ્ય ભારતમાં થાય છે.
 - એપીડા દ્વારા (APEIDA) બાસમતી ચોખા માટે જોગ્રોફીકલ ઈન્ડિકેશન Geographical Indication (GI) મેળવેલ છે.
- (A) 1 અને 2 વાક્યો યોગ્ય છે. (B) 1 અને 3 વાક્યો યોગ્ય છે.
(C) 2 અને 3 વાક્યો યોગ્ય છે. (D) 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
038. નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય છે ?
- રીજનલ રૂરલ બેન્ક (RRB) ની રચના સંસદના કાયદા મુજબ કરવામાં આવેલ છે.
 - RRB દ્વારા 90% ધિરાણ, પ્રાયોરીટી લેન્ડિંગમાં અને ગ્રામ વિસ્તારમાં કરવું ફરજિયાત છે.
 - દેશમાં ખેતીવાડી ક્ષેત્રનું મહત્તમ ધિરાણ સહકારી બેન્કો મારફત કરવામાં આવે છે.
- (A) 1, 2 અને 3 (B) માત્ર 3
(C) માત્ર 2 (D) માત્ર 1
039. નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે ?
- એન્ટી ડંપીંગ ડ્યુટી (Anti-dumping Duty) એ સંરક્ષણવાદી ટેરિફ છે. જેથી દેશના ઉદ્યોગો પરદેશી વસ્તુઓ સાથે યોગ્ય હરીફાઈ કરી શકે.
 - કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય અંદર કાર્યરત DGTR (Director General of Trade Remedies) એન્ટી ડંપીંગ અંગેની તપાસ કરે છે.
- (A) માત્ર 1 (B) માત્ર 2
(C) 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. (D) 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.

040. “ટીઝર લોન” (Teaser Loan) હાલમાં સમાચાર પત્રોમાં જોવા મળે છે, તે શું છે ?
- (A) પ્રાથમિક તબક્કામાં વ્યાજનો દર ઓછો હોય છે અને પછી વ્યાજનો દર વધે છે.
- (B) સમાજના ગરીબ અને નબળા વર્ગને ઓછા વ્યાજના દરે આપવામાં આવતી લોન.
- (C) ખુબજ મોટી રકમની, ખુબજ ઓછા દરે અને લાંબા ગાળાની લોન.
- (D) ખુબજ ધનવાન વ્યક્તિઓને આપવામાં આવતી લોન.
041. બેન્ક બોર્ડ બ્યુરો (Bank Board Buerau, BBB) ના મુખ્ય કાર્યો ક્યાં છે ?
1. બેન્કોની કાર્ય પદ્ધતી, ગર્વન-સમાં સુધારો કરવો.
2. બેન્કોની મુખ્ય જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી કરવી અને નામોની સરકારને ભલામણ કરવી.
3. ખરાબ વિરાણ (Bad Loans) ની અસર ઘટાડવા જાહેર ક્ષેત્રોની બેન્કોને નવી મુડી આપવી.
- (A) 1 અને 3 (B) 2 અને 3
- (C) 1 અને 2 (D) 1, 2 અને 3
042. જોગ્રાફીકલ ઈન્ડીકેશન ટેગ (Geographical Indication Tag - GI) સામાન્ય રીતે કોને આપવામાં આવે છે ?
1. ખેત ઉત્પાદનો (Agricultural Product)
2. ખાદ્ય પદાર્થો (Food Stuffs)
3. હેન્ડીક્રાફ્ટ (Handicrafts)
4. ઔદ્યોગીક વસ્તુઓ (Industrial Products)
5. વાઈન અને સ્પીરીટ પીણાઓ (Wine and Spirit Drinks)
- (A) 1, 2, 3 અને 4 (B) 1, 2, 4 અને 5
- (C) 1, 2, 3, 4 અને 5 (D) 2, 3, 4 અને 5
043. ભારતમાં દર વર્ષે બે વખત ફાયનાન્સીયલ રીપોર્ટ (Financial Report) કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ?
- (A) રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા (B) નીતિ આયોગ
- (C) નાબાર્ડ (D) નાણા મંત્રાલય
044. વીશ્વનો સૌથી મોટો તરતો સોલાર પ્રોજેક્ટ કઈ નદી ઉપર કાર્યવંત થનાર છે ? (World largest floating solar project)
- (A) ગંગા (B) નર્મદા
- (C) બ્રહ્મપુત્ર (D) કાવેરી
045. ઓપન માર્કેટ પૉલીસી (Open market policy) એ કઈ પ્રક્રિયાનો ભાગ છે ?
- (A) ક્રેડીટ પૉલીસી (Credit policy) (B) ડેબીટ પૉલીસી (Debit policy)
- (C) ડીપોઝીટ પૉલીસી (Deposit policy) (D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં

046. ભારતમાં 100 રૂ. ની અને 1 રૂ. ની નોટ ઉપર કોની સહી હોય છે ?
1. માન. રાષ્ટ્રપતિ
 2. માન. વડા પ્રધાનશ્રી
 3. માન. આર.બી.આય. ગર્વનરશ્રી
 4. માન. મંત્રીશ્રી નાણા વિભાગ
 5. માન. સચિવશ્રી નાણા વિભાગ
 6. માન. ચેરમેનશ્રી નીતિ આયોગ
- (A) માન. રાષ્ટ્રપતિ અને માન. મંત્રીશ્રી નાણા વિભાગ
 (B) માન. મંત્રીશ્રી નાણા વિભાગ અને માન. ચેરમેનશ્રી નીતિ આયોગ
 (C) માન. આર.બી.આય. ગર્વનરશ્રી અને મા. સચિવશ્રી નાણા વિભાગ
 (D) માન. સચિવશ્રી નાણા વિભાગ અને માન. ચેરમેનશ્રી નીતિ આયોગ
047. મીશ્ર અર્થતંત્ર (Mixed Economy) એટલે ?
- (A) ખેતી અને ઉદ્યોગોને, રાજ્ય દ્વારા સરખા પ્રમાણમાં પ્રોત્સાહન આપે છે.
 (B) જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ
 (C) નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન
 (D) ખાનગી ક્ષેત્ર અને ખેતીના વિકાસનો અભિગમ
048. રાજ્યસભાના સભાસદોની ચૂંટણીમાં મતદાન કોણ કરે છે ?
- (A) સામાન્ય મતદાર (B) લોકસભાના સભ્યશ્રીઓ
 (C) રાજ્ય વિધાન સભાના ચૂંટાયેલ સભ્યશ્રીઓ (D) લોકસભા, રાજ્ય વિધાન સભાના સભ્યશ્રીઓ
049. ભારતનાં બંધારણના આમુખમાં “સમાજવાદી બિન સાંપ્રદાયિક” શબ્દોનો સમાવેશ કયા બંધારણીય સુધારાને કારણે થયો. જેથી હવે “એક સર્વભૌમ સમાજવાદી, બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક” તરીકે આમુખમાં ઉલ્લેખ છે ?
- (A) સુધારા નં. 41 (B) સુધારા નં. 42
 (C) સુધારા નં. 43 (D) સુધારા નં. 44
050. મૂળભૂત હક્કો અનુચ્છેદ અનુક્રમ નંબરને યોગ્ય રીતે ગોઠવો.
- | મુળભૂત હક્કો | અચ્છેદ |
|---|--------|
| 1. વાણી સ્વાતંત્ર વગેરે સબંધી અમુક હક્કોનું રક્ષણ | a. 21 |
| 2. કાયદા સમક્ષ સમાનતા | b. 28 |
| 3. જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ | c. 19 |
| 4. ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા | d. 14 |
- (A) 1 - b, 2 - c, 3 - d, 4 - a (B) 1 - a, 2 - b, 3 - c, 4 - d
 (C) 1 - c, 2 - d, 3 - a, 4 - b (D) 1 - d, 2 - a, 3 - b, 4 - c
051. બંદી-પ્રત્યક્ષીકરણ, પરમ આદેશ, પ્રતિષેધ, અધિકાર પૃચ્છા, ઉત્પ્રેક્ષમ જેવી રિટનો ઉલ્લેખ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે ?
- (A) 29 (B) 30
 (C) 31 (D) 32

052. નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે ?

1. અનુચ્છેદ 37માં આ ભાગની જોગવાઈઓ કોઈ ન્યાયાલય અમલ કરાવી શકતી નથી પરંતુ કાયદો ઘડતી વખતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને લાગુ પાડવા રાજ્યની ફરજ છે.
2. અનુચ્છેદ 40 મુજબ ગ્રામપંચાયતોની રચના, જરૂરી સત્તા અને અધિકાર આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
3. કામ અંગેની ન્યાયી અને મનોવાંચિત પરિસ્થિતિ સિદ્ધ કરવાની જોગવાઈ અનુચ્છેદ 44 માં કરેલ છે.

(A) 1 અને 3

(B) 1 અને 2

(C) 2 અને 3

(D) 1, 2 અને 3

053. “SFURTI” યોજના (સ્ફૂર્તિ યોજના) કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?

(A) સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

(B) નાણા મંત્રાલય

(C) ગૃહ મંત્રાલય

(D) રક્ષા મંત્રાલય

054. નીચેના વાક્યો ચકાસો.

1. રાજ્ય સભાનું વિસર્જન થઈ શકશે નહિં પરંતુ 1/3 ની શક્ય હોય તેટલી નજીકની સંખ્યામાં દર બે વર્ષે સભ્યો નિવૃત્ત થશે.

2. લોકસભાની પહેલી બેઠકની તારીખથી 6 વર્ષ સુધી લોકસભા ચાલુ રહેશે.

(A) પ્રથમ વાક્ય યોગ્ય છે.

(B) બીજું વાક્ય યોગ્ય છે.

(C) પ્રથમ અને બીજું બન્ને વાક્યો યોગ્ય છે.

(D) પ્રથમ અને બીજું બન્ને વાક્યો યોગ્ય નથી.

055. નીચેના વાક્યો ચકાસો :

1. દરેક મંત્રીને તથા ભારતના એટર્ની જનરલને બે માંથી કોઈ પણ ગૃહમાં સંયુક્ત બેઠકમાં હાજરી આપવાનો હક્ક છે.

2. કાર્યવાહીમાં ભાગ લીધા બાદ જો મતદાન થાયતો મતદાનમાં ભાગ લેવાનો તથા મત આપવાનો હક્ક છે.

3. ભારતના ઉપ-રાષ્ટ્રપતિ હોદાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે.

(A) 1 અને 2 યોગ્ય છે.

(B) 2 અને 3 યોગ્ય છે.

(C) 1 અને 3 યોગ્ય છે.

(D) 1, 2 અને 3 બધાજ યોગ્ય છે.

056. નીચેના વાક્યો ચકાસો.

1. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બન્ને ગૃહના બનેલા મતદારગણના સભ્યો, મતદાન કરે છે અને ચૂંટણી પ્રસંગે ગુપ્ત મતદાનથી પસંદગી થાય છે.

2. જે વ્યક્તિ રાજ્ય સભાના સભ્ય તરીકે ચૂંટાવા લાયક ન હોય અથવા 35 વર્ષની ઉંમર પૂરી કરી ન હોય તે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પાત્ર નથી.

ઉપરોક્ત જોગવાઈ કયા અનુચ્છેદમાં કરાયેલ છે ?

(A) 64

(B) 65

(C) 66

(D) 67

057. નીચેના વાક્યો ચકાસો :

1. રાષ્ટ્રપતિ, વડાપ્રધાનને સંબોધીને પોતાના સહીથી પોતાના હોદાનું રાજીનામું આપી શકશે.

2. અનુચ્છેદ 65 માં જોગવાઈ કર્યા મુજબ રાષ્ટ્રપતિને મહા આરોપ (Impeachment) દ્વારા દૂર કરી શકાય છે.

3. રાષ્ટ્રપતિ સંસદના કોઈ પણ ગૃહ અથવા રાજ્યની વિધાન મંડળના ગૃહનો સભ્ય ન હોવો જોઈએ જો સભ્ય હોય તો હોદો સંભાળે તે તારીખથી તે બેઠક ખાલી કરી ગણાય છે.

(A) માત્ર 3 વાક્ય યોગ્ય છે.

(B) 1 અને 2 વાક્યો યોગ્ય છે.

(C) 2 અને 3 વાક્યો યોગ્ય છે.

(D) 1 અને 3 વાક્યો યોગ્ય છે.

058. નીચેની બાબતો માટે યોગ્ય અનુચ્છેદ ગોઠવો :

<u>વિગત</u>	<u>અનુચ્છેદ</u>
1. રાજ્યોના રાજ્યપાલો	a. 158
2. રાજ્યપાલની નિમણૂંક	b. 156
3. રાજ્યપાલના હોદ્દાની મુદત	c. 153
4. રાજ્યપાલના હોદ્દાની શરતો	d. 155

(A) 1 - c, 2 - b, 3 - a, 4 - d (B) 1 - d, 2 - c, 3 - b, 4 - a
(C) 1 - b, 2 - a, 3 - d, 4 - c (D) 1 - a, 2 - d, 3 - c, 4 - b

059. નીચેના પૈકી કયુ વાક્ય યોગ્ય નથી ?

- (A) ભારતમાં એક ઉચ્ચતમ ન્યાયાલય રહેશે અને ભારતના માન. મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત અન્ય મા. ન્યાયમૂર્તિઓ કાર્યવંત રહેશે.
(B) મા. ન્યાયમૂર્તિ 70 વર્ષની ઉંમર સુધી પોતાનો હોદ્દો ધરાવી શકે છે.
(C) મા. ન્યાયમૂર્તિ પોતાનું રાજીનામું માન. રાષ્ટ્રપતિને સાદર કરે છે.
(D) કામ ચલાઉ મા. મુખ્ય ન્યાયમૂર્તિની જોગવાઈ અનુચ્છેદ 126 માં કરવામાં આવેલ છે.

060. નીચેના વાક્યો ચકાસો.

1. પંચાયત અંગેની જોગવાઈઓ 71માં સુધારા મુજબ અમલી બનેલ છે.
2. પંચાયત અંગેના સુધારાઓ તા. 24-4-93થી અમલમાં આવેલ છે.
3. મધ્યવર્તી સ્તરની અથવા જિલ્લા સ્તરની સંસ્થાઓમાં સરકાર દ્વારા અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવે છે.
4. પંચાયતની સામાન્ય સંજોગોમાં મુદત પાંચ વર્ષની હોય છે.
(A) 1 અને 4 વાક્યો યોગ્ય નથી. (B) 1 અને 2 વાક્યો યોગ્ય નથી.
(C) 1 અને 3 વાક્યો યોગ્ય નથી. (D) 1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય નથી.

061. નીચેના વાક્યો ચકાસો.

1. કેન્દ્રીય સર્તકતા આયોગને 25-ઓગસ્ટ 1988ના રોજ “વૈધાનિક દરજ્જો” આપવામાં આવેલ હતો.
2. આયોગમાં અધ્યક્ષ ઉપરાંત ત્રણ સભ્યો હોય છે.
3. ભ્રષ્ટાચાર હોદ્દાનો દુરઉપયોગ જેવી બાબતોની તપાસ કરીને યોગ્ય તે પગલા ભરવા આયોગ ભલામણ કરે છે.
ઉપરોક્ત પૈકી કયા વિધાનો યોગ્ય છે ?
(A) 1 અને 2 (B) 2 અને 3
(C) 1 અને 3 (D) 1, 2 અને 3

062. નીચેના વાક્યો ચકાસો.

1. લોકપાલ અને લોકાયુક્ત કાયદો - 2013, ને માન. રાષ્ટ્રપતિએ 1 જાન્યુઆરી 2014ના રોજ મંજૂરી આપેલી હતી અને 16 જાન્યુઆરી 2014થી આ કાયદો અમલમાં આવેલ હતો.
2. લોકપાલમાં અધ્યક્ષશ્રી ઉપરાંત મહત્તમ આઠ સભ્યોની નીમણૂંક કરી શકાય છે.
(A) પ્રથમ અને બીજુ વાક્ય યોગ્ય છે. (B) માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે.
(C) માત્ર બીજુ વાક્ય યોગ્ય છે. (D) પ્રથમ અને બીજુ વાક્ય, બન્ને યોગ્ય નથી.

063. લોક સેવા આયોગની જોગવાઈઓ અને સંબંધિત અનુચ્છેદની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
- (A) સંઘને એક લોક સેવા આયોગ અને દરેક રાજ્યને એક લોક સેવા આયોગ હશે – અનુચ્છેદ-315
- (B) સભ્યોની નિમણૂકની જોગવાઈ – અનુચ્છેદ-317
- (C) લોક સેવા આયોગના કાર્યો – અનુચ્છેદ-320
- (D) લોક સેવા આયોગના રિપોર્ટ – અનુચ્છેદ-323

064. નીચેના વાક્યો ચકાસો.

1. પંચાયતોની તમામ ચૂંટણીઓની સંપૂર્ણ કાર્યવાહીની જવાબદારી રાજ્ય ચૂંટણી કમિશનમાં નિહિત થાય છે. આ માટેની જોગવાઈ અનુચ્છેદ 243 ક (243 K) માં કરવામાં આવેલી છે.
2. લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણી અંગેની જવાબદારી અનુચ્છેદ 324 હેઠળ - ઈલેક્શન કમિશનમાં નિહિત થાય છે.

- (A) પ્રથમ વાક્ય યોગ્ય છે. (B) બીજું વાક્ય યોગ્ય છે.
- (C) પ્રથમ અને બીજું બન્ને વાક્યો યોગ્ય છે. (D) પ્રથમ અને બીજું બન્ને વાક્યો યોગ્ય નથી.

065. ખાલી જગ્યા પુરો.

2	6	3	?
80	24	120	36

- (A) 7 (B) 8
- (C) 9 (D) 10

066. ખાલી જગ્યા પુરો.

84		81		88	
14	12	18	9	?	11

- (A) 16 (B) 21
- (C) 24 (D) 28

067. L, M, N, O, P, Q, R, S, T ને અનુક્રમે 1 થી 9 નંબર આપેલ છે. પરંતુ આ નંબરો ક્રમાનુસાર નથી. P માટે 4 નંબર આપેલ છે. P અને T વચ્ચે 5 નંબરનો તફાવત છે અને T અને N વચ્ચે 3 નો તફાવત છે. આ સંજોગોમાં N ને કયો નંબર આપેલ હશે ?

- (A) 7 (B) 6
- (C) 5 (D) 4

068. એક કુટુંબના 12 બાળકોની સરેરાશ ઉંમર 11 વર્ષ છે. જો દાદાની ગણતરી કરવામાં આવે તો સરેરાશ ઉંમર 15 વર્ષ થાય છે. દાદાની ઉંમર કેટલી હશે ?

- (A) 52 વર્ષ (B) 63 વર્ષ
- (C) 68 વર્ષ (D) 72 વર્ષ

069. એક સંખ્યાના $\frac{1}{4}$ ભાગના $\frac{2}{5}$ ભાગ 72 થાય છે. તો તે સંખ્યા કઈ હશે ?
- (A) 360 (B) 540
(C) 720 (D) 900
070. એક ટાંકીનો નળ 12 કલાકમાં ટાંકી ભરી શકે છે. પરંતુ જો બીજો નળ ખોલવામાં આવે તો 18 કલાકમાં ટાંકી ખાલી થઈ જાય છે. જો બન્ને નળ ખોલવામાં આવે તો ટાંકી કેટલા વખતમાં ભરાશે ?
- (A) 18 કલાક (B) 36 કલાક
(C) 54 કલાક (D) 72 કલાક
071. એક વેપારી મુળ કિંમત ઉપર 20% નફો ઉમેરીને 20% વળતર આપે છે. આ સંજોગોમાં તેને કેટલાં ટકા નફો-નુકસાન થશે ?
- (A) 4% (B) 5%
(C) 8% (D) કોઈ નફો કે નુકસાન થશે નહીં
072. 70 મીટર લાંબી ગાડી, 90 મીટર લાંબા પ્લેટફોર્મને 4 સેકન્ડમાં પસાર કરે છે. તો ગાડીની ઝડપ કેટલી હશે ?
- (A) 60 કિમી/કલાક (B) 72 કિમી/કલાક
(C) 90 કિમી/કલાક (D) 144 કિમી/કલાક
073. ખાલી જગ્યા પુરો.

29	13	18
33	?	19
33	27	3

- (A) 19 (B) 15
(C) 14 (D) 8
074. એક મોટર સાયકલના પૈડાની ત્રિજ્યા 35 સે.મી. છે. તો 11 કિમી અંતર કાપવા પૈડુ કેટલા આંટા મારશે ?
- (A) 2,500 આંટા (B) 3,000 આંટા
(C) 4,000 આંટા (D) 5,000 આંટા
075. પાંચ ચોરસ મીટર કાપડમાંથી 50 સે.મી.ના કેટલા ચોરસ કપડાના નેપકીન બની શકે ?
- (A) 10 નેપકીન (B) 100 નેપકીન
(C) 1000 નેપકીન (D) 10,000 નેપકીન
076. રૂ. 720 માં એક ખુરશી વેચવાથી 20% ખોટ જાય છે જો 20% નફો મેળવવો હોય તો તે ખુરશી કેટલામાં વેચવી જોઈએ ?
- (A) 720 રૂ. (B) 900 રૂ.
(C) 1080 રૂ. (D) 1200 રૂ.

077. ખાલી જગ્યા પુરો.

3	370	7
2	224	6
1	730	?

- (A) 5 (B) 7
(C) 9 (D) 11

078. નીચેના પૈકી કઈ જોડીઓ દર્શાવતુ વાક્ય નથી ?

- (A) ડૉ. ટેસી થોમસ – મિસાઈલ પ્રોજેક્ટ સંચાલન કરનાર પ્રથમ મહિલા
(B) ડૉ. ગીતા વર્દન – સાયબર સિક્યુરીટી અને રિમોટ સેન્સિંગ ઉપગ્રહની કામગીરી
(C) રીતુ કરિષલ – રોકેટ વુમન ઑફ ઈન્ડિયા
(D) કમલા રણદીવ – પ્રથમ માઈક્રોવેવ એન્જિનીયર

079. બાયો ગેસમાં સૌથી વધારે માત્રા શેની હોય છે ?

- (A) કાર્બન ડાયોક્સાઈડ - Carbon dioxide (B) મીથેન - Methane
(C) હાયડ્રોજન - Hydrogen (D) હાયડ્રોજન સલ્ફાઈડ - Hydrogen Sulphide

080. ચૉક (Chalk) અને આરસ (Marble) કે શેના પ્રકાર છે ?

- (A) કેલ્શીયમ હાયડ્રોજન કાર્બોનેટ - Calcium hydrogen carbonate
(B) કેલ્શીયમ કાર્બોનેટ - Calcium carbonate
(C) કેલ્શીયમ એસીટેટ - Calcium acetate
(D) સોડીયમ કાર્બોનેટ - Sodium carbonate

081. ઓન્કોલોજી (Oncology) એ કયા બાબતનો અભ્યાસ કરે છે ?

- (A) પક્ષીઓ (Birds) (B) કેન્સર (Cancer)
(C) જમીન (Soil) (D) સસ્તન પ્રાણી (Mammals)

082. ધી ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ (The International Solar Alliance - ISA) નું સચિવાલય કયા સ્થળે આવેલ છે ?

- (A) પેરીસ (Paris) (B) નવી દિલ્હી (New Delhi)
(C) ગુરુગ્રામ (Gurugram) (D) ન્યુ યૉર્ક (New York)

083. આરકા સોમા (Arka Soma) અને આરકા ત્રિશ્ના (Arka Trashna) એ શાની નવી જાતો છે ?

- (A) દ્રાક્ષ (Grapes) (B) ટામેટા (Tomato)
(C) જમરૂબ (Guava) (D) સંતરા (Orange)

084. નેશનલ બ્યુરો ઑફ ઓઈલ સર્વે એન્ડ લેન્ડ યુઝ પ્લાનીંગ (National Bureau of Soil Survey and Land Use Planning) નું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલ છે ?

- (A) હૈદરાબાદ (Hyderabad) (B) દિલ્હી (Delhi)
(C) પૂણે (Pune) (D) નાગપુર (Nagpur)

085. બાર ચુંબકમાં ચુંબકની મધ્યમાં ચુંબકત્વ (Magnetism) કેટલું હોય છે ?

- (A) મહત્તમ (B) લઘુત્તમ
(C) શુન્ય (D) બધે સમાન હોય છે.

086. રડાર (RADAR) શાના ઉપયોગમાં લેવાય છે ?
 (A) દરીયાની અંદર રહેલ સબમરીન શોધવા
 (B) રેડીયો તરંગોની ક્ષમતા માપવા
 (C) પાણીમાં રહેલ તત્વોના અભ્યાસ માટે
 (D) વિમાન, અવકાશી સાધનો, પક્ષીઓ વગેરેના સ્થળ શોધવા માટે
087. ધી રાણી ઝાસી મરીન નેશનલ પાર્ક (RJMNP) કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલ છે ?
 (A) પુડુચેરી (B) ઓડિશા
 (C) અંદામાન નિકોબાર દ્વીપસમૂહ (D) કેરળ
088. ભારતમાં નેશનલ સાયન્સ ડે (National Science Day) દર વર્ષે કઈ તારીખે ઉજવાય છે ?
 (A) 28 ફેબ્રુઆરી (B) 27 ફેબ્રુઆરી
 (C) 26 ફેબ્રુઆરી (D) 25 ફેબ્રુઆરી
089. લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીનું મર્જ/એકત્રીકરણ કઈ ચેનલ/સંસ્થા સાથે થયેલ છે ?
 (A) એનડીટીવી (NDTV) (B) ઝી ટીવી (Zee TV)
 (C) સંસદ ટીવી (Sansad TV) (D) આજ તક
090. ભારતના ખેલાડી આર. વિનય કુમાર (R. Vinay Kumar) દ્વારા નિવૃત્તી જાહેર કરવામાં આવેલ છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ હતા ?
 (A) બોક્સીંગ - Boxing (B) વજન ઉપાડવાની રમત - (Weight lifting)
 (C) ક્રિકેટ - (Cricket) (D) હૉકી - (Hockey)
091. G-20 બાબતે નીચેના વાક્યો ચકાસો :
 1. આ સમીટના સભ્યો 80% દુનિયાના GDPનો હિસ્સો ધરાવે છે, 75% વેપાર અને 60% વસ્તીના હિસ્સો ધરાવે છે.
 2. સને 1999 થી દર વર્ષે G-20 ની બેઠક મળે છે.
 3. 30 અને 31 ઑક્ટોબર 2021 ના રોજ રોમ ખાતે હવે બેઠક મળનાર છે.
 (A) પ્રથમ અને બીજી વાક્ય યોગ્ય છે. (B) બીજી અને ત્રીજી વાક્ય યોગ્ય છે.
 (C) પ્રથમ અને ત્રીજી વાક્ય યોગ્ય છે. (D) પ્રથમ, બીજી અને ત્રીજી વાક્ય યોગ્ય છે.
092. રમતના મેદાનો અને તેના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
 1. નરેન્દ્ર મોદી સ્ટેડીયમ a. કોલકત્તા - Kolkatta
 2. ઈએમએસ (EMS) સ્ટેડીયમ b. ભુવનેશ્વર
 3. ક્લીંગા સ્ટેડીયમ c. કોઝી કોડી - Kozhikode
 4. વીવેકાનંદ યુવા ભારતી કીરાંગન d. અમદાવાદ
 (A) 1 - c, 2 - b, 3 - a, 4 - d (B) 1 - d, 2 - c, 3 - b, 4 - a
 (C) 1 - b, 2 - a, 3 - d, 4 - c (D) 1 - a, 2 - d, 3 - c, 4 - b
093. ગુજરાતના રમતવીરો અને રમતના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ?
 (A) હેતુલ શાહ - શતરંજ
 (B) સરીતા ગાયકવાડ - દોડવીર
 (C) લજ્જા ગોસ્વામી - નિશાન બાજ સ્ત્રી (Marks woman)
 (D) અંકીતા રૈના - ક્રિકેટ (Cricket)

094. રમતની ટ્રોફી (Trophy) અને રમતના જોડકાઓ પૈકી કયા જોડકા યોગ્ય છે ?
1. ક્રિકેટ - જી.ડી. બીરલા ટ્રોફી (G.D. Birla Trophy)
 2. બેડમીન્ટન - નારંગ કપ (Narang Cup)
 3. હાંકી - ચારમીનાર ટ્રોફી (Charminar Trophy)
 4. ફુબોલ - ફેડરેશન કપ (Federation Cup)
- (A) 1, 2 અને 4 (B) 2, 3 અને 4
(C) 1, 3 અને 4 (D) 1, 2, 3 અને 4
095. ગુજરાત રાજ્યનું સને 2021-2022ના વર્ષનું બજેટ વિધાનસભામાં ક્યારે રજૂ કરવામાં આવેલ હતું ?
- (A) 28 ફેબ્રુઆરી - 2021 (B) 1 માર્ચ - 2021
(C) 2 માર્ચ - 2021 (D) 3 માર્ચ - 2021
096. રમત અને તેમાં ઉપયોગમાં લેવાતા શબ્દોની જોડીઓ યોગ્ય રીતે ગોઠવો.
- | | |
|----------------------------|-------------------------------|
| 1. ફુટબોલ - Football | a. બેક હેન્ડ - Back hand |
| 2. બ્રીજ - Bridge | b. પીન્ચીંગ - Pinching |
| 3. બેસ બોલ - Base ball | c. ગ્રેન્ડ સ્લેમ - Grand slam |
| 4. બેડ મીન્ટન - Bad minton | d. કીક - Kick |
- (A) 1 - d, 2 - c, 3 - b, 4 - a (B) 1 - c, 2 - b, 3 - a, 4 - d
(C) 1 - b, 2 - a, 3 - d, 4 - c (D) 1 - a, 2 - d, 3 - c, 4 - b
097. સીટી ઇન્નોવેશન એક્સચેન્જ (City Innovation Exchange) (CIX) પ્લેટફોર્મ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?
- (A) ગૃહ મંત્રાલય - Home Affairs
(B) હાઉસીંગ અને અર્બન અફેર્સ મંત્રાલય - Housing and Urban Affairs
(C) ઈલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી. મંત્રાલય - Electronics & I.T.
(D) શિક્ષણ મંત્રાલય - Education
098. જલ શક્તિ મંત્રાલય દ્વારા, ફેઝ 4 અન્વયે સ્વચ્છ આયકોનીક પ્લેસીસ (Swachh Iconic Places) (SIP) માટે નીચેના પૈકી કોની પસંદગી થયેલ નથી ?
- (A) અજંતા ગુફા - મહારાષ્ટ્ર (B) લાલ કિલ્લા - દિલ્હી
(C) કુંભલગઢ ફોર્ટ - રાજસ્થાન (D) બાકે બીહારી મંદીર - મથુરા
099. કોવીડ વેક્સીન - COVAX Scheme અંતર્ગત પ્રથમ વેક્સીન મેળવનાર કયો દેશ છે ?
- (A) સુદાન (B) ધાના
(C) ઈથોપીયા (D) ઈજિપ્ત
100. હાલમાં આસામ સરકારને નીચેની પૈકી કઈ સંસ્થાએ 304 મીલીયન ડોલર (\$) ની લોન પાવર સેક્ટર માટે આપેલ છે ?
- (A) ADB - Asian Development Bank
(B) વર્લ્ડ બેન્ક - World Bank
(C) એ.આઈ.આઈ.બી. (AIIB) - The Asian Infrastructure Investment Bank
(D) ન્યુ ડેવલપમેન્ટ બેન્ક - New Development Bank

101. Who said that the “only one social responsibility of business is to increase profit”?
- (A) Edward Freeman (B) Milton Friedman
(C) Michael Porter (D) None of the above
102. What are the four generic strategies of social responsiveness?
- (A) Proaction, Defensiue, Peinestment, Reaction
(B) Reaction, Defence, Inuvestment, Withdrawl
(C) Reaction, Defence, Accommodation, Proaction
(D) None of the above
103. Both Michael Porter and Mark Kramer said that _____.
- (A) Social responsibility can help firms to discover future business opportunities
(B) Social responsibility does not matter for firm strategies
(C) Social responsibility is a long term investment in a company advertising and public relations
(D) None of the above
104. When management takes a positive view towards CSR activities and thus is willing to partially participate in these activities a invest some corporate resources in them is called _____.
- (A) Confrontation Strategy (B) Accommodation Strategy
(C) Reaction Strategy (D) None of the above
105. According to Section 135 of Companies Act 2013 the loud of every company shall ensure that the company spends in every financial year, at least 2% of the average net profits of the company made during the _____ immediately preceding financial years, in pursuance of its corporate social responsibility policy
- (A) 3 (B) 2
(C) 5 (D) None of the above
106. The recognition of the close link between an organizations decisions and activities and its impact on the natural environment is called _____.
- (A) Greening of Management (B) Light Green Approach
(C) Dark Green Approach (D) None of the above
107. The Corporate governance structure of a company reflects the company’s _____
- (A) Cultural and Economic System (B) Legal and Business System
(C) Social and Regulatory System (D) All of the above
108. Corporate Social Responsibility while appropriating natural resources by a corporate entity has been recommended in which of the following.
- (A) Montreal Protocol of 1987
(B) Millennium Development Goals 2008
(C) Sustainable Development Goals 2015 in Global Sustainability Report
(D) UNDP Human Development Report
109. Compulsory Audit Partner relation was recommended by which of the following committee?
- (A) Naresh Chandra Committee (B) Kumar Mangalam Birla Committee
(C) Narayan Murthy Committee (D) J.J. Irani Committee
110. The Earth Summit in Rio resulted in a blue print on how the make development socially, economically and environmentally sustainable and is termed as _____
- (A) Earth Agenda (B) Rio Agenda
(C) Agenda 21 (D) None of the above

111. According to Kumar Mangalam Birla Committee, how many times at least in a year should a company held board meetings
- (A) 4 (B) 5
 (C) 6 (D) None of the above
112. _____ tracks the environmental impacts of a product from its new material through disposal at the end of its useful life
- (A) Life cycle Assessment (B) Product Environment Assessment
 (C) Product Regeneration Assessment (D) None of the above
113. Which of the following is/are considered CSR activities under the new companies Law?
- (A) Contribution to State Government Funds
 (B) Contribution to Political Parties
 (C) Measures to benefit armed forces veterans
 (D) None of the above
114. Information Technology (Amendment) Act, 2008 has come into force on
- (A) 27 October 2009 (B) 27 October 2008
 (C) 17 October 2000 (D) None of the above
115. Under which section of IT Act, stealing any digital asset or information is written as Cyber crime?
- (A) 65 (B) 65-D
 (C) 67 (D) 70
116. Section _____ along with Section _____ IT Act 2000 specifies that the act is applicable to any offence or contravention committed outside India as well
- (A) 2(1), 74 (B) 1(2), 75
 (C) 3(1), 57 (D) None of the above
117. Information technology Act 2000 amended which of the following Act(s)
- (A) The Indian Evidence Act 1872 (B) The Bankers Books Evidence Act 1891
 (C) Reserve Bank of India Act (D) All of the above
118. What is the punishment in India for stealing computer documents, assets or any softwares source code from any organization, individual or from any other means?
- (A) 6 month of imprisonment and a fine of Rs. 50,000/-
 (B) 1 year of imprisonment and a fine of Rs. 1,00,000/-
 (C) 2 years of imprisonment and a fine of Rs. 2,50,000/-
 (D) 3 years of imprisonment and a fine of Rs. 5,00,000/-
119. Section _____ of the Information Technology Act 2000 criminalises the sending of offensive messages through a computer or other communication devices
- (A) 64(A) (B) 65(A)
 (C) 66(A) (D) None of the above
120. Which one of the following does not qualify for curtailing the freedom of speech and expression under Indian Constitution
- (A) Security of State (B) Public order, Decency, Morality
 (C) Demand for Autonomy (D) Contempt of Court

121. The office of Registration of Newspaper of India came into existence in the year _____, on the recommendations of the _____.
- (A) 1956; first press commission (B) 1954; press trust of India 1951
(C) 1936; parliamentary committee (D) None of the above
122. In the imprintline, which of the title/nomenclature is required to be used as per guidelines of RNI?
- (A) Editor-in-chief (B) Editor
(C) Chief-Editor (D) Resident Editor
123. The National Payment Corporation of India has approved which of the following social media platform to enter unified payment Interface (UPI)?
- (A) Telegram (B) Zoho
(C) Whatsapp (D) None of the above
124. Which of the following is Made in India social media applications?
- (A) Koo (B) Elyments
(C) Zoho'sArattai (D) All of the above
125. In case of any cyber Attack in India which of the following organization is the national nodal agency for responding to computer security incidents
- (A) Cyber Security Division of National Disaster Management Authority
(B) Indian Computer Emergency response team
(C) Cyber Security Division of Ministry
(D) None of the above
126. The FM Station owned by Malayala Manorama group is _____
- (A) Radio DC (B) Radio Mango
(C) Kerala Radio (D) Radio Onattukara
127. "The Medium is the Message" and the electronic media has transformed the world into a global village are theirs of whom?
- (A) Marshal Mc Luhan (B) Jeffrey Cole
(C) Max Mc comles (D) None of the above
128. Which of the following theory says that people use media only the satisfy specific needs?
- (A) Reception Analysis (B) Magic Bullet
(C) Uses and gratification (D) None of the above
129. The _____ is a political science and mass communication theory proposed by German political scientist Elisabeth Noelle Neumann
- (A) Spiral of Silence Theory (B) Cultivation theory
(C) Third Percent Effect (D) None of the above
130. Agence France Press one of the world's oldest news agency headquartered in Paris was founded in the year _____
- (A) 1901 (B) 1835
(C) 1847 (D) None of the above
131. Who is the Author of the book "The Media and Democracy"
- (A) Walter Lippmann (B) HerbeckGans
(C) John Keane (D) None of the above

132. Who was Indian representative to Macbride Commission?
 (A) Boobli George Verghese (B) Sam Pitroda
 (C) A.G. Noorani (D) G.S. SubramanyaAiyer
133. 'Business Suite' a tool to help small business is launched by
 (A) Twitter (B) Snapchat
 (C) Whatsapp (D) None of the above
134. Facebook has launched Social Media Marketing Professional certificate in collaboration with
 (A) Coursera (B) Skillshare
 (C) Udacity (D) None of the above
135. Social media major _____ has recently launched a dedicated prompt named _____ for resources on mental health and suicide prevention
 (A) Twitter; There is help (B) Facebook; Callhelp
 (C) Telegram; Value Yourself (D) None of the above
136. Which country launched a campaign named 'Asol Chini' to curb fake information on social media?
 (A) Sri Lanka (B) Myanmar
 (C) Bangladesh (D) Thailand
137. "Comment is free; facts are Sacred". Who made this statement?
 (A) C.P. Scott (B) Brian Robert
 (C) William Francis (D) James Goldsmith
138. In Electronic Media 'Dolly' stands for _____.
 (A) Curved length blue grey background in a TV studio
 (B) Platform on wheels, on which a camera is mounted
 (C) Small microphone picking sound from one direction only
 (D) None of the above
139. Which of the following is not part of Section 135 of the Indian Companies Act 2013.
 (A) CSR Activities undertaken in India will be taken into consideration
 (B) If any profit is earned from the CSR activities, that amount will have to be reinvested by the company.
 (C) Activities meant exclusively for employees and their families will not qualify under CSR
 (D) The company can implement its CSR activities in domains listed under Schedule-VII of the act.
140. The first Radio Programme in India was broadcast by _____ in the year _____.
 (A) Radio Club of Madras; 1924 (B) Radio Club of Calcutta; 1921
 (C) Radio Club of Bombay; 1923 (D) None of the above
141. Which of the following is/are basis for development of CSR rules in India?
 (A) CSR Voluntary Guidelines 2009 (B) National Voluntary Guidelines 2011
 (C) Both (A) and (B) (D) None of the above
142. Section _____ of IT Act 2000 which was introduced in the year 2008 was invalidated by the Supreme Court in the year _____?
 (A) 68 A, 2014 (B) 66 A, 2015
 (C) 67 A, 2016 (D) None of the above

143. What is the maximum penalty for damage to computer system as per section 43 of the IT Act 2000?
 (A) Rs. 50 lakhs (B) Rs. 1 Crore
 (C) Rs. 2 Crore (D) None of the above
144. What is the punishment for identity theft in IT Act?
 (A) 2 years of imprisonment or 2 lakh rupees penalty or both
 (B) 3 years of imprisonment or 1 lakh rupees penalty or both
 (C) 1 year of imprisonment or 50 thousand rupees penalty or both
 (D) None of the above
145. Under section 48(1) of IT Act the Central Government shall, by notification, establish one or more appellate tribunal to be known as _____.
 (A) Cyber Regulations Disruption Tribunal
 (B) Cyber Regulations Appellate Tribunal
 (C) Cyber Regulations Management Tribunal
 (D) None of the above
146. _____ means a system of a secure key pair consisting of a private key for creating a digital signature and a public key to verify the digital signature
 (A) Symmetric Crypto System (B) Asymmetric Crypto System
 (C) Digital Keying System (D) Hybrid Electronic Crypto System
147. Which of the following is NOT a correct statement with respect to freedom of speech and expression in India?
 (A) It is enshrined in Part III of the Constitution
 (B) It is not an absolute right to express ones thoughts freely
 (C) It cannot be curtailed by legislation
 (D) None of the above
148. In India defamation is a _____.
 (A) Civil offence (B) Criminal offence
 (C) Both (A) and (B) (D) None of the above
149. Article _____ of Indian Constitution guarantees the freedom of speech and expression as one of its six freedoms
 (A) 19 (B) 18
 (C) 17 (D) None of the above
150. Freedom of speech is not _____ as the _____ imposes restrictions on the right to freedom of speech and expression and one of them is _____.
 (A) Absolute; Article 19(2); defamation
 (B) Sacrosanct; Article 20; Right to disagree
 (C) Right; Article 19(3); Right to Peaceful Protest
 (D) None of the above
151. With respect to MJ Akbar vs PriyaRamani defamation case verdict, Delhi High Court ruled that
 (A) A Woman cannot be punished for raising voice against sexual abuse
 (B) A women should be carefull at work place
 (C) A women should raise voice against sexual abuse in manner so that it dies not lead to defanation of an individual
 (D) None of the above

152. Which of the following is the defence mechanism against defamation?
 (A) If it were the public good
 (B) To publish a substantially true report of the proceedings of a court of justice
 (C) To express in good faith any opinion with respect to the conduct of a public servant in the discharge of his public function
 (D) All of the above
153. _____ is a method of defamation expressed by print, writing, pictures, signs, or any communication. Embodied in physical form that is injurious to a person's reputation
 (A) Slander (B) Libel
 (C) Lien (D) None of the above
154. The defamation depicted in transient form through words spoken or gestures is called as _____.
 (A) Libel (B) Slander
 (C) Lien (D) None of the above
155. The essential characteristics of defamation include _____.
 (A) The statement must be defamatory
 (B) The said statement must refer to the plaintiff
 (C) The statement must be published/communicated to at least one person other than the claimant
 (D) All of the above
156. Defamation is defined in Section _____ of the IPC Act
 (A) 488 (B) 495
 (C) 499 (D) None of the above
157. Which of the following bills was withdrawn by the Government of India
 (A) The Defamation Bill 1987 (B) The Defamation Bill 1988
 (C) The Defamation Bill 1989 (D) None of the above
158. In which of the cases did the Supreme Court of India scrap Section 66A of the IT Act 2008?
 (A) Shreya Singhal vs Union of India (B) Subramanian Swamy vs Union of India
 (C) Arvind Kejriwal vs Union of India (D) None of the above
159. _____ is the aggregate of an individual's passive and active online activity.
 (A) Digital Body Language (B) Digital Body Surfing
 (C) Digital Body Screening (D) None of the above
160. _____ is the process of gathering information relating to a particular topic or area of interest, usually with the intention of adding value.
 (A) Content Curation (B) Content Negation
 (C) Content Validation (D) None of the above
161. A line at the top or bottom of a newspaper page that gives the newspaper name, section, page number and publication date is called _____.
 (A) Folio (B) Imprintline
 (C) Middle (D) None of the above
162. Quid Pro Quo is a _____ word often used in describing political and administrative corruption?
 (A) Latin (B) Greek
 (C) Italian (D) None of the above

163. Free Press of India was founded by _____.
 (A) K.C.Roy (B) SwaminathanSadanand
 (C) R.B. Goenka (D) None of the above
164. National Press Day is celebrated on _____.
 (A) November 1 (B) October 21
 (C) November 16 (D) None of the above
165. Some stories that wrap similar event into a single is called _____.
 (A) Multiple story (B) Round
 (C) Capital story (D) None of the above
166. What percentage of FDIs allowed in Indian cinema?
 (A) 26% (B) 51%
 (C) 100% (D) None of the above
167. Leader Writer is one who writes the _____ either in the absence of the editor or in case where the editor chooses not to write.
 (A) Main story (B) Middle Article
 (C) Editorial (D) None of the above
168. 'XXX' in a news paper copy denotes _____.
 (A) End of the story (B) End of thirty words
 (C) Story written by 3 people (D) None of the above
169. Sensation is the main features of _____ journalism.
 (A) Black (B) Yellow
 (C) Red (D) None of the above
170. Narrowing Communication Gap between high and low segments of socio-economic status through redundancy in communication messages is called as _____.
 (A) The entropy net (B) The communication loop
 (C) The Ceiling Effect (D) None of the above
171. Crystallising Public Opinion was authored by _____.
 (A) Black Sam (B) Edward L. Bernay
 (C) Berlo (D) None of the above
172. The first Chairman of the Press Council of India was _____.
 (A) Justice J.R. Mudholkar (B) Justice V.R. Krishna Iyer
 (C) Justice M. Katju (D) None of the above
173. The Code of Ethics drawn in 1978 was a form of self censorship by _____.
 (A) The Indian languages Newspaper Association
 (B) The Advertising standards council of India
 (C) All India Newspaper Editors Conference
 (D) None of the above
174. The Community Radio Concept is identified with _____.
 (A) Broadcasting (B) Narrowcasting
 (C) Personal casting (D) Podcasting

175. The first book printed by Johann Guttenberg was on _____.
- (A) Short stories (B) Poetry
 (C) Religion (D) None of the above
176. _____ is a rich media, Primarily images and videos that are only accessible for a brief period
- (A) Ephemeral content (B) Disappearing content
 (C) Evaporating content (D) None of the above
177. “CSR Can’t be merely a job, it’s a passion” who said this statement?
- (A) Shri Ratan Tata (B) Smt. Sudha Murthy
 (C) Shri Rahul Bajaj (D) None of the above
178. What is the user threshold mandated for defining a ‘Significant’ Social media intermediary
- (A) 25 lakh (B) 50 lakh
 (C) 75 lakh (D) No such limit
179. Which of the following statements is/are correct regarding Editors Guild of India?
1. All individuals, who are functioning editors of bonafide, general interest newspapers, news agencies or periodicals, shall be eligible for membership.
 2. Editors of house journals, trade magazines and the like shall not be eligible for membership.
 3. The area of operations of the Guild shall be all India or as may be decided from time to time.
- (A) 1, 2 and 3 (B) 2 and 3 only
 (C) 1 and 3 only (D) 1 and 2 only
180. Which of the following statements is/are correct regarding Press council of India (PCI)?
1. Press council of India is a Statutory body
 2. The PCI was first set up in the year 1966 by the Parliament
 3. The parliament of India established the PCI was established on the recommendations of the committee under the chairman of Sardar vallabhai Patel
- (A) 1, 2 and 3 (B) 2 and 3 only
 (C) 1 and 2 only (D) 1 and 3 only
181. Which of the following statements is/are correct regarding Prasar Bharati?
- (A) The Parliament of India passed the Prasar Bharati Act enacted in 1990, but it was implemented in 1997
- (B) The President of India appoints the Chairman and the other Members, except the ex officio members, nominated member and the elected members
- (C) Both (A) and (B)
 (D) Neither (A) nor (B)
182. Which of the following pairs is, are correctly matched?
1. DD Chandana - Karnataka
 2. DD Yadgiri - Telangana
 3. DD Sapthagiri - Andhra Pradesh
 4. DD Podhigai - Kerala
- (A) 1, 2, 3 and 4 (B) 1, 2 and 3 only
 (C) 2, 3 and 4 only (D) 1, 2 and 4 only

183. Which of the following statements is/are correct regarding All India Radio (AIR)?
1. 'Bahujan Hitaya : Bahujan Vikas is the motto of All India Radio
 2. AIR's home service comprises of 470 Broadcasting centres located across the country
 3. AIR covering nearly 80% of the country's area and 81% of the total population
 4. AIR originates programming in 23 languages and 179 dialects.
- (A) 1, 2, 3 and 4 (B) 1, 2 and 3 only
 (C) 2 and 4 only (D) 2, 3 and 4 only
184. Which of the following wings is/are not part of the Ministry of Information and Broadcasting ministry of India?
- (A) Information Wing (B) Publication wing
 (C) Films Wing (D) Broadcasting wing
185. Which of the following statements is/are correct regarding Ministry of Information and Broadcasting?
1. There are total 10 media units are there under the ministry
 2. Total 7 autonomous bodies are there under the ministry
 3. Press Council of India and Film certification Appellate Tribunals are the Statutory bodies
 4. Two public Sector Undertakings are there under the ministry
- (A) 1, 2, 3 and 4 (B) 2, 3 and 4 only
 (C) 1, 2 and 3 only (D) 1 only
186. Which of the following statements is/are correct regarding new rules of Government of India on OTT platforms?
1. The OTT platforms would self-classify the content into five age based categories - U (Universal), U/A 7+, U/A 13+, U/A 16+, and A (Adult).
 2. Platforms would be required to implement parental locks for content classified as U/A 13+ or higher.
 3. A Five-level grievance redressal mechanism has been established under the rules with different levels of self-regulation
- (A) 1, 2 and 3 (B) 2 and 3 only
 (C) 1 and 2 only (D) 1 and 3 only
187. Which of the following statements is/are correct regarding Pilaji Rao Gaekwad?
1. First he was appointed by the Peshwa to collect revenues from territories of Gujarat.
 2. Pilaji Rao established himself at fortress of Songadh.
 3. Pilaji Rao defeated Rustom Ali Khan the governor of Junagadh
- (A) 1 and 2 only (B) 1, 2 and 3 only
 (C) 2 and 3 only (D) 1 and 3 only
188. The first princely state to make primary education free and compulsory was _____.
- (A) Mysore (B) Baroda
 (C) Hyderabad (D) Gwalior
189. PragMahal' in kutch is located next to the _____ and constructed in _____ style?
- (A) Aina Mahal, Persian (B) Aina Mahal, Italian Gothic
 (C) Ramji Mahal, European (D) Ramji Mahal, Italian Gothic

190. The Imperial Gazetteer of India observed that the following places of Bombay presidency witnessed the revolt of 1857 _____.
- (A) Rajkot, Kutchh (B) Bhavnagar, Valsad and Surat
(C) Junagad, Bhavnagar and Surat (D) Karachi, Ahmedabad and Kolhapur
191. Which place of Gujarat is popular for lacquered wood work?
- (A) Sankheda (B) Dangs
(C) Dahod (D) Rajkot
192. The testimony of the early existence of Buddhism in Gujarat is seen at _____.
1. Temple of Dwaraka
 2. Step well of Adalaj
 3. Asokan Rock edict in Junagadh
- (A) 1 and 3 only (B) 3 only
(C) 2 and 3 only (D) 1, 2 and 3
193. In which of the following areas of Gujarat the Gamadia dialect is used in which areas?
- (A) Around Saurashtra (B) Around South Bharuch
(C) Around Ahmedabad and Vadodara (D) Around Peninsular Gujarat
194. Which of the following statements is correct regard to “Paakho” and “Kaharekh”?
- (A) They are the embroideries of Kutch
(B) They are regional cuisine of North Gujarat
(C) They are the ritual system in South Gujarat
(D) None of the above
195. In which of the following cities “Premanand Sahitya Sabha is situated”?
- (A) Navsari (B) Nadiad
(C) Dahod (D) Vadodara
196. The earliest evidence of Brahmanical thought in Gujarat is evident from which period?
- (A) The Mauryan period (B) Maitraka period
(C) Gupta period (D) Vaghela period
197. This folk painting has the exclusive monopoly of women artists and symbolic figures are found in it. Paintings are 2D in effect and gaps are filled with figures and patterns. It is _____.
- (A) Pochampalli painting (B) Madhubani painting
(C) Manjusha painting (D) Snake painting
198. Which of the following statement/s is/are correct regarding Mata Ni Pachedi?
- (A) It is a cloth art that constitutes a temple of the goddess
(B) people of the Vaghari community of Gujarat prepared this first time
(C) This ingenuous solution is believed to be the origin of Mata ni Pachedi, the sacred art.
(D) All of the above
199. Who among the following Gujarati authors first awarded Jananpith award from Gujarat?
- (A) Mahendra Pandya (B) Govardhanram Tripati
(C) Umashankar Joshi (D) DalpathRam
200. Who among the following was the founder of Bal hanuman Temple of Jamnagar?
- (A) Prembhikshuji (B) Chandradev
(C) karnadev (D) Siddaraj Jaysinh

201. In which of the following periods the Sarai architecture has been started in Gujarat?
 (A) Moughal Time (B) European Time
 (C) Maratha Time (D) None of the above
202. Match the following List I with List II
- | List-I | List-II |
|--------------------------------|--------------------------------|
| a. Vaghji Palace | 1. Mundha |
| b. Navlakho Palace | 2. Morbi |
| c. Ranjitvilas Palace | 3. Vadodara |
| d. Laxmivilas Palace | 4. Vankaner |
| (A) a - 2, b - 1, c - 4, d - 3 | (B) a - 1, b - 2, c - 3, d - 4 |
| (C) a - 4, b - 3, c - 2, d - 1 | (D) a - 3, b - 4, c - 1, d - 2 |
203. Which of the following statements is/are correct?
 (A) The Baroda Museum and Picture Gallery has an Egyptian Mummy in its collection.
 (B) Kutch Museum has Muthuva Textiles
 (C) Both (A) and (B)
 (D) Neither (A) nor (B)
204. Which of the following statements is/are correct?
 (A) The Anarta tradition or Anarta ware is a chalcolithic culture
 (B) The ceramics similar to the Anarta tradition was first reported from Surkotada with Classical Harappan ceramics.
 (C) The Anarta ware found from Patan and Kutch districts of Gujarat
 (D) All of the above
205. Which one of the following is the earliest known Gujarati text?
 (A) Bharat-bahubali ras (B) Arthashtra
 (C) Ananda mala (D) Duyashaya
206. Which of the following tribes of Gujarat are also known as Khandeshi Bhils?
 (A) Bhawcha (B) Barda
 (C) Siddhi (D) Kolga
207. Central Salt and Marine Chemicals Research Institute is located at which of the following places in Gujarat?
 (A) Gandhinagar (B) Bhavnagar
 (C) Porbandar (D) Rajkot
208. The Gujarat state exposes rocks belonging to the _____ eras.
 1. Pre Cambrian
 2. Mesozoic
 3. Paleozoic
 4. Cenozoic
 (A) Only 1 (B) Only 2 and 3
 (C) Only 1, 2 and 4 (D) 1, 2, 3 and 4

209. Which of the following mines of Gujarat related to Lignite production?
1. Panandhro
 2. Umarsar
 3. Rajparidi
 4. Mevasa
- (A) 1 and 2 only (B) 2 and 3 only
 (C) 1, 2 and 3 only (D) 1, 2, 3 and 4
210. Which of the following district is not part of Sagarkhedu Sarvangi Vikas Yojana by government of Gujarat?
- (A) Ahmedabad (B) Porbandar
 (C) Amreli (D) None of the above
211. Which of the following statements is/are correct regarding Fundamental Rights?
- (A) Article 33 empowers the parliament to restrict or abrogate the fundamental rights of the armed forces.
 (B) The parliament law enacted under article 33 can also exclude the court martial from the writ jurisdiction.
 (C) Both (A) and (B)
 (D) Neither (A) nor (B)
212. Which of the following is a prevention of detention laws made by parliament?
1. Maintenance of Internal Security Act 1978
 2. National Security act 1980
 3. Prevention of Terrorism Act 2002
 4. Conservation of Foreign exchange and prevention of smuggling activities act 1974
- (A) 1, 2, 3 and 4 (B) 2, 3 and 4
 (C) 1, 2 and 4 (D) 1 and 3 only
213. Supreme court held that a religious denominations must satisfy three condition, in this regard which of the following is/are correct?
1. It should have a common organization
 2. It should be designated by a distinctive name
 3. It should be a collection of individuals who have a system of beliefs
- (A) 1 and 2 only (B) 2 and 3 only
 (C) 1 and 3 only (D) 1, 2 and 3
214. Which of the following pairs is/are correct regarding minority educational institutions?
1. In granting aid the state shall not discriminate against any educational institutes managed by a minority or majority.
 2. Minority institutions can seek recognition from the government but not the aid.
 3. Some minority institutes neither seek recognition nor seek aid from the government.
- (A) 1, 2 and 3 (B) 3 only
 (C) 1 and 3 only (D) None of the above

227. Which of the following pairs is/are correctly matched regarding Writs?
- (A) Habeus Corpus - Principle of Locus Standi does not apply for this writ
 (B) Mandamus - this writ is issued to public officials
 (C) Prohibition - this is not available against a public officer without Judicial or quasi judicial powers
 (D) All of the above
228. Which of the following statements is/are correct regarding Dual membership in the legislatures?
- (A) If a person is member in the both parliament and state legislature and if he don't resign from one seat, it is deemed that he has vacated the seat in the parliament.
 (B) If a person is member in the both the houses of parliament, if he does not resign from one house, it is deemed that he retained the seat which he was elected earlier.
 (C) Both (A) and (B)
 (D) Neither (A) nor (B)
229. Which of the following statements is/are correct?
1. Vanabandhu Kalyan Yojana is also known as Chief Minister's 10 point programme.
 2. Urban Development is also one of the component in this VKV scheme.
 3. All weather Roads and Qualitative and Sustainable Employment are other two components in this programme.
- (A) 1 and 3 only (B) 2 and 3 only
 (C) 1 only (D) 1, 2 and 3
230. Which of the following rocks belongs to the sedimentary rocks?
1. Basalt
 2. Limestone
 3. Shale
 4. Granite
- (A) 1, 2 and 3 only (B) 2 and 3 only
 (C) 1, 2 and 4 only (D) 1, 2, 3 and 4
231. Which of the following statements is/are correct regarding 2011 census?
1. Gujarat's population was more than 6 crores.
 2. Gujarat's population in the age group of 15-59 years was 3.8 crores.
 3. Percentage decadal growth rate of population of Gujarat was less than India.
- (A) 1 and 3 only (B) 2 only
 (C) 1 and 2 only (D) 1, 2 and 3
232. Which of the following statements is/are correct regarding Ball Clay mineral in Gujarat?
- (A) High grade ball clay is available in Surat.
 (B) Gujarat is the largest ball clay producer in Asia
 (C) Both (A) and (B)
 (D) Neither (A) nor (B)

246. Which of the following statement about decadal population growth (2001-2011) is true about Gujarat?
- (A) The decadal growth rate of population of Gujarat is lowest in India
 (B) The decadal growth rate of population of Gujarat is highest in India
 (C) The decadal growth rate of population of Gujarat is higher than that of India
 (D) The decadal growth rate of population of Gujarat is lower than that of India
247. SujalamSufalam Yojana of Gujarat is related to _____ .
- (A) Land Reforms (B) Agricultural Credit
 (C) Technological upgradation (D) Soil health card
248. Coral Reefs are considered Fragile Eco Systems, the reason for this is _____.
- (A) Agriculture and Urban Runoff pollute coastal water resulting in algal blooms
 (B) They are sensitive to water temperatures
 (C) Both (A) and (B)
 (D) None of the above
249. Which of the following statements is/are correct regarding Garib Samruddi Yojana of the Government of Gujarat?
- (A) This programme is a flagship programme of the Urban Development and Housing Department of GoG.
 (B) The scheme envisages a holistic approach for providing better housing for the urban poor.
 (C) Both (A) and (B)
 (D) Neither (A) nor (B)
250. Which of the following scheme is adopted by Gujarat State Government to enhance primary education?
- (A) Vidhyalaxmi Bond Yojana (B) VidhyadeepYojana
 (C) School-Health Check up Program (D) All of the above
251. The 17 Sustainable Development Goals (SDGs) are having _____ number of targets?
- (A) 159 (B) 169
 (C) 179 (D) None of the above
252. In the theory of demographic transition in the last stage _____
- (A) Birth rate rises, death rate also rises (B) Birth rate rises, while death rate falls
 (C) Birth rate falls, while death rate rises (D) Both birth rate and death rate falls
253. A biological community in its environment such as a pond, an ocean, a forest, even an aquarium is known as
- (A) Community (B) Biome
 (C) Biodiversity (D) Ecosystem
254. Which of the following statements is/are correct regarding to Gujarat?
1. As per govt of Gujarat the Inflation (CPI combined) rate is 4.15%.
 2. The dropout rate of children (from lto 5th class) is 1.42%
 3. The Fiscal deficit of GSDP is 11.66%
- (A) 1, 2 and 3 (B) 2 and 3 only
 (C) 1 and 3 only (D) 1 and 2 only

255. The protocol which seeks to protect biological diversity from the potential risks posed by genetically modified organisms resulting from modern biotechnology is called _____.
- (A) Montreal Protocol (B) Geneva Protocol
(C) Cartagena Protocol (D) Stockholm Protocol
256. What is cloud seeding?
- (A) A method to produce artificial rain
(B) Planting seeds in anticipation of expected rains.
(C) A method of faster data transfer using cloud computing.
(D) A method to produce highly productive varieties of plants
257. Which of the following statements is/are correct?
1. The water cycle involves the processes of evaporation, condensation, precipitation and transpiration.
 2. Both water and carbon cycles are examples of perfect cycles.
 3. Nitrogen can be consumed by plants directly from the atmosphere.
- (A) 1 only (B) 2 and 3 only
(C) 1 and 2 only (D) 1, 2 and 3
258. The approximate representation of forests in India is _____.
- (A) 43% (B) 21%
(C) 29% (D) 23%
259. Which one of the following regions of India has a combination of mangrove forest, evergreen forest and deciduous forest?
- (A) North Coastal Andhra Pradesh (B) South-west Bengal
(C) Southern Saurashtra (D) Andaman and Nicobar Islands
260. In which of the following are corals not found?
- (A) Gulf of Kutch (B) Gulf of Khambat
(C) Gulf of Mannar (D) None of the above
261. Which of the following is a green house gas but not an air pollutant?
- (A) Oxides of nitrogen (B) Carbon dioxide
(C) HFCs (D) CFCs
262. Which industry is the largest consumer of water?
- (A) Textile Industry (B) Iron & Steel Industry
(C) Food Processing (D) Coal Industry
263. Identify the correct sequence with reference to environmental clearance for the new projects:
- (A) Screening → Scoping → Public Consultation → Appraisal
(B) Public Consultations → Appraisal → Screening → Scoping
(C) Appraisal → Screening → Scoping → Public Consultation
(D) Scoping → Public Consultation → Appraisal → Screening

264. Which of the following is a primary cause of soil degradation in irrigated cultivated land in India?
- (A) Silting of land (B) Salinity of soil
(C) Gully erosion (D) Wind erosion
265. Which of the following is INCORRECT regarding the Speaker of the Lok Sabha?
- (A) The Speaker is responsible for upholding the privileges of the House
(B) The salary of the speaker is charged on Consolidated Fund of India
(C) Constitutionally, the speaker is not expected to vote in the first instance
(D) None of the above
266. Which of the following statements is/are correct regarding Adult Franchise in India?
- (A) The Voting age was reduced from 21 years to 18 years in 1989 by the 61st Constitutional amendment
(B) Article 326 provides for Universal adult franchise
(C) Both (A) and (B)
(D) Neither (A) nor (B)
267. Which of the following statements is INCORRECT about 'Anti Defection Law'?
- (A) A nominated member of a house will be disqualified if he joins any political party within six months of his/her nomination.
(B) If an independent legislator joins a political party he would lose membership.
(C) He can choose to support any political party but should not attach himself to any political party.
(D) If a sole member of a political party in an Assembly joins another political party, he will be disqualified.
268. Which of the following statements is/are INCORRECT in the context of questions and discussions in Parliament?
- (A) Half-an-hour discussions can be held on important matters raised in starred, unstarred and short notice questions
(B) According to Lok Sabha rules, "Zero Hour" is held after Question Hour
(C) During question Hour, debate on any matter cannot be raised through questions
(D) None of the above
269. If the Prime Minister of India belonged to the Upper House of Parliament?
- (A) He will not be able to vote in his favour in the event of a no-confidence motion
(B) He will not be able to speak on the budget in the Lower House
(C) He can make statements only in the Upper House
(D) He has to become a member of the Lower House within six months after being sworn in as the Prime Minister
270. Which of the following qualification is given in the constitution to be elected as a commissioner of Election commission?
- (A) Being in Indian Administrative Service
(B) Shall have Experience of at least 5 years as a lawyer in a High Court
(C) Completion of 35 years of age
(D) None of the above

271. Which of the following are true regarding the powers of the two houses of the Parliament?
(A) The Rajya Sabha has equal powers with Lok Sabha in amending the constitution.
 (B) The council of states can censure the council of ministers
(C) The emergence powers of the two houses are co equal
(D) The two houses have coequal electoral powers
272. Why does the Government of India promote the use of 'neem-coated urea' in agriculture?
(A) Release of neem oil in the soil increases nitrogen fixation by the soil microorganisms.
 (B) Neem coating slows down the rate of dissolution of urea in the soil.
(C) Nitrous oxide, which is a greenhouse gas, is not at all released into the atmosphere by the crops.
(D) Neem-coated urea is a combination of weedicide and fertiliser for specific crops.
273. Which of the following is not a type of ex situ conservation method?
(A) Botanical garden (B) Seed vault
 (C) National parks (D) Gene banks
274. The Little Rann of Kutch is the only home of _____.
 (A) The Indian Wild Ass (B) Blackbuck
(C) Hangul (D) None of the above
275. Which one of the following is the national aquatic animal of India?
(A) Saltwater crocodile (B) Olive ridley turtle
 (C) Gangetic dolphin (D) Gharial
276. In which one of the following categories of protected areas in India are local people not allowed to own private land?
(A) Biosphere reserves (B) National parks
(C) UNESCO world heritage sites (D) Wildlife sanctuaries
277. Sustainable Development Goal-13 is related to _____.
(A) Clean water and sanitation (B) Climate Action
(C) Life below Water (D) Life on Land
278. Which of the following indicators is/are not covered under Human Development Index?
(A) Per capita income (B) Life Expectancy
(C) Infant Mortality (D) None of the above
279. Which of the following gases has the highest global warming potential?
(A) Methane (B) Nitric oxide
(C) Carbon dioxide (D) Hydro chlorofluorocarbons
280. Which of the following documents in the reform era officially declared Agriculture as an Industry?
(A) National Agriculture Insurance Scheme 1999
 (B) National Agriculture policy 2000
(C) Tax reforms commission 2000
(D) None of the above

281. Pradhan Mantri Jeevan Jyothi Bima Yojna (PMJJBY), offers coverage for death due to any reason and is available to people in the age group of between?
(A) 18 to 60 years (B) 18 to 62 years
(C) 18 to 50 years (D) 18 to 65 years
282. Which of the following fundamental rights has been used by courts to address the concerns of daily life of the citizens of India?
(A) Right to life (B) Right to freedom
(C) Right to equality (D) Right to constitutional remedies
283. By convention, which of the following committees of parliament is headed by a member of the opposition party?
(A) Estimates committee (B) Committee on public enterprises
(C) Ethics committee (D) Public accounts committee
284. Who among the following have the right to vote in the elections to both the Lok Sabha and Rajya Sabha?
(A) Elected members of the Lower House of the Parliament
(B) Elected members of the Lower House of the State Legislature
(C) Elected members of the Upper House of the Parliament
(D) Elected members of the Upper House of the State Legislature
285. Though the Council of Ministers is collectively responsible to the Lok Sabha, the individual Ministers are constitutionally responsible to _____.
(A) The Speaker (B) The President
(C) The Prime Minister (D) None of the above
286. Under which of the following condition(s) a writ of mandamus can be granted?
(A) There must be a public duty
(B) There must be a specific demand and refusal
(C) There must be a clear right to enforce the duty
(D) All of the above
287. India's parliamentary system has a feature which is unusual in usual Parliamentary politics. Which among the following is it?
(A) Minister belong to the legislature
(B) President is the part of the Parliament
(C) Ministers work under the leadership of the Prime Minister
(D) Collective responsibility of the minister is towards the Lok Sabha.
288. Right to vote in Lok Sabha and State Assembly elections is a _____.
(A) Constitutional right (B) Statutory right
(C) Fundamental right (D) Moral right
289. Which of the following schedules explains about the Rajya Sabha representation of different States and Union Territories?
(A) Second (B) Sixth
(C) Fourth (D) Ninth

290. Which of the following statement/s is/are correct regarding to Office of Profit?
- (A) The word 'office of profit' has been elaborately defined in the Constitution and the Representation of People's Act of 1951.
- (B) An MP or MLA is barred from holding an office of profit as it can put him in a position to gain a financial benefit.
- (C) Both (A) and (B)
- (D) Neither (A) nor (B)
291. 'Twenty-points programme' was a flagship programme for _____.
- (A) Rural development (B) Urban Development
- (C) Tribal Development (D) None of the above
292. Which of the following statements is/are correct regarding recently launched "Anna Brahma Scheme" of Gujarat?
- (A) This scheme is for migrant labourers from other states stuck during COVID-19 lockdown in the state.
- (B) Non ration card holder migrant workers will get food grains and other food items absolutely free under this scheme.
- (C) Both (A) and (B)
- (D) Neither (A) nor (B)
293. Which of the following statements is/are correct?
- (A) The state government has started the Gunotsav Programme in 2009
- (B) The dropout rate for elementary section (Std. I-V) has decreased substantially from 22.30 percent in 1999-00 to 1.40 percent in 2018-19.
- (C) Both (A) and (B)
- (D) Neither (A) nor (B)
294. Which of the following statements is/are correct regarding recent Economic Survey of Gujarat?
- (A) With only 4.99 per cent population share, Gujarat accounts for 8.11 percent share to National GDP
- (B) Gujarat is 5th largest state in milk production in India.
- (C) The Per Capita Power Consumption has increased from 1910 KWh in 2015-16 to 2225 KWh in 2019-20.
- (D) All of the above
295. Any citizen of India can contest election to the Legislative Assembly if he/she attains the age of?
- (A) 21 years (B) 25 years
- (C) 26 years (D) 18 years
296. Which of the following statements is/are correct regarding Election Commission of India?
1. The President appoints Chief Election Commissioner and Election Commissioners.
 2. They have tenure of six years, or up to the age of 62 years, whichever is earlier.
 3. The Chief Election Commissioner can be removed from office only through impeachment by Parliament.
- (A) 1, 2 and 3 (B) 1 and 3 only
- (C) 2 and 3 only (D) 1 and 2 only

297. Which of the following is the criteria required to become a of National Political Parties?
- (A) It has to win a minimum of two per cent of the seats in the Lok Sabha from at least three different states
 - (B) The party is recognised as a 'state level party' in Six or more states.
 - (C) Both (A) and (B)
 - (D) Neither (A) nor (B)
298. Which of the following statements is/are INCORRECT regarding Deposit amount in elections?
- (A) To contest a Parliamentary election, the amount is Rs 25,000
 - (B) In case of an Assembly election, it is Rs 10,000.
 - (C) If the candidate gets fewer than one -tenth of the total number of valid votes cast in the constituency, his security deposit will be lost.
 - (D) None of the above
299. Which of the following statements is/are correct?
- (A) The 61st Constitutional Amendment act, 1988 reduced the voting age from 21 to 18
 - (B) The election commission of India made multi member body in 1990.
 - (C) Both (A) and (B)
 - (D) Neither (A) nor (B)
300. Which of the following statements is/are correct regarding Voter registration in India?
- (A) General Voters need to fill Form 6, This form is also for 'First time voters'
 - (B) Form 7 for voters who have shifted to another constituency
 - (C) NRI Voter need to fill form 8
 - (D) Form 9 for changing the name, photo and age